



# WORLD ZOROASTRIAN ORGANISATION TRUSTS

WZO Trust Funds | WZO Trust for Women & Children | World Zoroastrian Organisation Trust



25<sup>TH</sup>  
ANNIVERSARY  
SENIOR CITIZENS' CENTRE, NAVSARI

BAI MANECKBAI P.B. JEEJEEBHOY, SENIOR CITIZENS' CENTRE, NAVSARI

WZO Trust Funds  
WZO Trust for Women & Children  
World Zoroastrian Organisation Trust



**TRUSTEES:**

Dinshaw Tamboly

Farrokh Kasad

Bachi Tamboly

Farzana Mojgani

Aspi Ambapardiwala

Cyrus Vandriwala

Rohinton Contractor

Homiyar Madan

Freyaz Shroff

.....  
**Photo credits:** Sarosh Daruwalla (Mazda Studios)

**Designed by:** Malcolm Todiwalla

**Printed by:** Union Press (January 2023)

**Address:**

C-1 Hermes House, 3rd Floor,  
Mama Parmanand Marg,  
Opera House, Mumbai 400 004

**Phone:**

+91 22 2368 4451  
+91 22 2368 4452  
+91 22 2368 4453

Website: [www.wzotrust.org](http://www.wzotrust.org)

Facebook: [wzotrustfunds](https://www.facebook.com/wzotrustfunds)

YouTube: [World Zoroastrian](https://www.youtube.com/WorldZoroastrian)

**Organisation Trust & WZO Trust Funds**



Our always busy kitchen team with Administrator & Trustee



Falooda



Housie gift to Dolly, one of the winners!



Resident Dolly, spinning wool for Kusti



Visiting residents who needed to be hospitalised at D. N. Mehta Hospital

# CELEBRATING 25 YEARS

## *A time for reaffirming gratitude, introspection & reflection*

It is a matter of great pride and joy for us to be celebrating the 25th Anniversary of our WZO Trust Funds, Bai Maneckbai P. B. Jeejeebhoy Senior Citizens Centre at Pinjar Street, Malesar, Navsari.

January 06, 1998 was a very proud day for us for that is when our Centre became operational in the service of our community.

### **Reaffirming Gratitude:**

The journey of a thousand miles always begins with the first step. That first step was taken during the course of a conversation Bachi & I were having with late Mrs. Scylla R. Vatcha sometime during early 1995, when we were discussing community related issues. At that time World Zoroastrian Organisation Trust and WZO Trust for Women & Children had already been established in 1991 & 1993 respectively. The objects of these two Trusts were limited to Medical, Education, Relief from Poverty, and Farmers Rehabilitation.

Mrs. Scylla Vatcha who from the inception of our welfare activities in 1991 had been our principal supporter, took keen interest in our activities, mentioned during the course of the discussions that many Zoroastrian families were living in cramped accommodations, many a times three generations together, which did not provide adequate privacy for the younger generations and we should look into establishing a Centre for Senior Citizens that would cater to individuals who were mobile and capable of looking after themselves.

The idea appealed to us and we set about scouting for suitable property in the island city of Mumbai. However, with suitable locations being difficult to find and also land prices in Mumbai being astronomical we suggested to her that she should consider establishing a Centre for Senior Citizens at Navsari, where we had our base in addition to that at Mumbai.

Scylla immediately agreed to our proposal, laying down three simple conditions:

- (1) The Centre should be conveniently located in a predominantly Parsi precinct**
- (2) Be near to an Agiyari**
- (3) Be easily accessible to a market place**

We thereafter set about locating a suitable place and were fortunate to find one at Pinjar street, that met all the three conditions.

Once this was done, we realized that our existing Trusts did not have establishing a Centre for Senior Citizens as one of its objectives, and being advised that it was easier to establish a new Trust than changing the objectives of an existing Trust we set about

establishing a new Trust – WZO Trust Funds having multiple objectives such as not only Centre for Senior Citizens, but also establishing Sanatoriums, as we had already begun discussing with Scylla the modalities of purchasing a palatial bungalow at Sanjan and converting it into a Sanatorium, as well as a project to provide interest free micro credit scheme to individuals who wished to be Self-Employed.

WZO Trust Funds was registered on August 31, 1995 immediately after which we began the task of establishing our Bai Maneckbai P. B. Jeejeebhoy Senior Citizens Centre. Plans for constructing a building of 20,000 sq. feet spread over ground + 5 floors were drawn up, statutory permissions received and work began in April 1996. Within the space of 21 months our Centre was ready for occupation in all respects.

The full cost of constructing the edifice as well as fully furnishing the same in all respects was borne by Scylla through her Bai Maneckbai P. B. Jeejeebhoy Deed of Settlement Fund.



It is to the eternal credit of Scylla, the visionary that she was, who foresaw that some residents at our Centre could become bed ridden, and considering our set up being for those who were mobile, it would not be possible to take care of them at our Centre. She, during her only visit to Navsari whilst the construction of the Centre was underway suggested that we should have a tie up with the Infirmary at Navsari (another fine institution) whereby those of our residents who had become bed ridden would be provided admission. Considering the fact that the Infirmary had limited capacity, Scylla immediately approved funds for constructing an additional building at the Infirmary.

Dear Scylla, through her Bai Maneckbai P. B. Jeejeebhoy Deed of Settlement Fund, had indeed created the foundation upon which many of our projects were conceived all of which have elevated the life styles of thousands of our community members.

Scylla will always be remembered as a doyenne of philanthropy. Our everlasting gratitude will always remain for dear Scylla, for without her support the Centre would not have seen the light of day.

The other stalwart without which the Centre would not have been what it is today – a vibrant haven of peace and tranquility – is our very own Bachi Tamboly, my wife as well as a founder Trustee of WZO Trust Funds. Whatever fame the Centre has achieved is only due to the dynamism with which she has pursued her mission & vision of doing something distinct and tangible for our Senior Citizens.

The Centre that she has shaped is reflective of her personality, firm but caring, planning centered around creating a facility that would be a 'home away from home' for the residents, where all residents, whether paying or residing gratis, all enjoying the same facilities, their self-respect and dignity remaining intact at all times.

Without these two ladies, Scylla & Bachi, the Senior Citizens Centre would have remained just a dream.

We are also very grateful to the multitude of donors who keep on extending financial support from time to time towards the running of our Centre.

Our very sincere gratitude, specially to Zoroastrian Charity Funds of Hong Kong, Canton & Macao for the regular support they extend every quarter.

### **Introspection & Reflection:**

We have always believed that it is only through candid introspection that we could identify our strong points and make them stronger, and at the same time it would enable us to recognise our weak ones and go about strengthening them.

The early days of our existence, were a learning curve. Managing an institution where 50+ mobile senior citizens from different walks of life resided peacefully in a vibrant environment, living, eating, spending time and relating with one another is an experience in itself, certainly not for the faint hearted.

We learnt quickly that managing a group of senior citizens from diverse walks of life is a continuing process in itself, not an objective that can ever be reached. A very important trait that we learnt quickly was to be rapid and impartial in sorting out issues whenever they arose, providing counsel that our institution would remain strong when united but weak when divided. This approach has been successful in making sure each one understands and appreciates the viewpoints of one other.

By and large, our Centre has been blessed to have as residents, individuals who are kind, supportive of each other, especially when any of their colleagues face personal issues.

All residents, except those who are temporarily ill, sitting together for meals, spending time playing carrom, cards, viewing television, at times singing songs, giving or receiving advice to one another,

bonding with one another as part of an extended family are a treat in itself to observe.

Ours is perhaps the only institution of its kind within our community where two sets of residents decided to get joined in matrimony. These events were a source of great joy and pride, indicative of the vibrancy of our Centre.

As our residents are meant to be mobile, we have over the years been arranging outings for them, spread over a few days to visit Iranshah at Udvarda and stay over at our nearby Sanatorium at Sanjan. These outstation trips are a much sought after and enjoyed event.

### **Acknowledging our management team and staff:**

We are very fortunate to have with us, Sharmin, Homi, Sarosh & Sam, who constitute our very dedicated team that manages the day-to-day operations, our team of 5 ladies who man the kitchens dishing out delicacies' day after day, 4 kitchen helpers and support staff of 16 ladies who clean the rooms and keep the Centre spanking clean at all times.

We extend sincere gratitude to all of them for the commitment and dedication with which they go about their duties.

We take this opportunity to remember and acknowledge services of our two Chef's Khorshed and Bapsy who were with us from the beginning for 23 years till such time they were afflicted by Covid-19 and passed on. We also acknowledge the services of our erstwhile Manager Soli who too was with us for 23 years but retired due to indifferent health.

### **In Conclusion:**

Our objectives have always been to ensure that our residents spend the evening of their lives with smiles on their lips, not tears in their eyes, replace their wrinkles with twinkles, keeping them always aware at all time that age is just a number for those who have the ability to appreciate the beauty in their lives, they never grow old.

Our residents, are illustrative of the immortal words of Robert Browning:

*“Come, grow old along with me!  
The best is yet to be,  
the last of life,  
for which the first was made”*



**Dinshaw K. Tamboly**  
Chairman

# 25 વર્ષની ઉજવણી.

આભાર, આત્મપોષ અને પરાવર્તનને પુનઃસમર્થન કરવાનો સમય

(A time for reaffirming gratitude, introspection & reflection)

WZO ટ્રસ્ટ ફંડસ, બાઈ માણેકબાઈ પી. બી. જીજીભોય સિનીયર સિટીઝન્સ સેન્ટર, પીંજાર સ્ટ્રીટ, મલેસર, નવસારીની 25મી એનીવર્સરીની ઉજવણી કરવી એ અમારા માટે બહુ જ અભિમાન અને આનંદની વાત છે.

૦૬ જાન્યુઆરી, ૧૯૯૮ એ અમારા માટે ખૂબ જ સારો દિવસ હતો જ્યારે અમારું સેન્ટર આપણા સમાજની સેવા માટે શરૂ થયું.

## ફરીથી આભાર:

હજારો માઈલની સફર હંમેશા પહેલા પગલાથી શરૂ થાય છે. તે પહેલું પગલું ૧૯૯૮ની શરૂઆતમાં સ્વર્ગસ્થ શ્રીમતી સીલ્વા આર. વાચ્છા સાથે બચી અને મારી વાતચીત વખતે લેવામાં આવેલું હતું, જ્યારે અમે સમાજ માટે લાગતાવળગતા મુદ્દાઓ પર વાત કરી રહ્યા હતા. તે વખતે વર્લ્ડ ઓરાસ્ટ્રીયન ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટ અને WZO ટ્રસ્ટ ફોર વુમન એન્ડ ચિલ્ડ્રનની અનુક્રમે ૧૯૯૧ અને ૧૯૯૩ માં સ્થાપના થઈ ગયેલી હતી. આ બે ટ્રસ્ટસના હેતુઓ (ઓબ્જેક્ટીવ્સ) મેડીકલ, શિક્ષણ, ગરીબી માટે મદદ અને ખેડૂતો ગામમાં સચવાયેલા રહે તેવા સુધી જ હતા.

અમને મુખ્ય સર્પોર્ટ કરનાર શ્રીમતી સીલ્વા વાચ્છા અમારા કામકાજમાં ૧૯૯૧થી જ ઊંડો રસ લેતા હતા અને ત્યારથી લોકોના ભલાઈ માટેના કામકાજની શરૂઆત થઈ હતી. તેમણે અમારી સાથે વાતચીત કરતી વખતે કહ્યું હતું કે ઘણા જરથોસ્તી ફેમીલીસ બહુજ સાંકડા ઘરોમાં રહેતા હતા, ઘણી વખત ત્રણ-ત્રણ પેઢીઓ સાથે રહેતી હતી, જેથી જુવાન બચ્ચાઓ માટે પ્રાઈવસી રહેતી નહીં હતી. જેથી આપણે હાલીયાલી શકતા અને પોતાની સંભાળ પોતે રાખી શકતા માણસોને સગવડ પુરી પાડી શકાય તેવી મોટી ઉંમરના (સિનીયર) માણસો માટે એક સેન્ટર બનાવવા પર ધ્યાન આપવું જોઈએ.

આ વિચાર અમને ગમી ગયો અને અમે ટાપુઓના શહેર મુંબઈમાં ચોક્કસ સારી મિલકત શોધવાનું શરૂ કર્યું. જો કે, જે જોઈએ તેવી જગ્યાઓ શોધવાની મુશ્કેલી હોવાથી અને મુંબઈમાં નહીં પોસાય તેવી જમીનની કિંમતો હોવાથી અમે સીલ્વાને જણાવ્યું કે તેમને નવસારીમાં સિનીયર માણસો માટે સેન્ટર બનાવવાનો વિચાર કરવો જોઈએ, કે જ્યાં મુંબઈ ઉપરાંત નવસારીમાં પણ અમો પહેલાથી કામકાજ કરતાં હતાં.

સીલ્વાએ તરત જ અમારી સામે ત્રણ સહેલી શરતો મૂકી અને અમારી વાત માની ગયા.

- (1) સેન્ટર પારસીઓની વસ્તી વધારે હોય તેવા સારા એરિયામાં હોવું જોઈએ,
- (2) અગિયારીની પાસે હોવું જોઈએ,
- (3) બજારની જગ્યાએ સારી રીતે પહોંચી શકાય તેવું હોવું જોઈએ.

ત્યારપછી અમે એક સારી જગ્યા શોધવાનું નક્કી કર્યું અને અમારા નસીબે ત્રણેય શરતો પુરી થાય તેવી રીતે પીંજાર મહોલ્લામાં એક જગ્યા મેળવવામાં સફળ થયા.

એકવાર આ જગ્યા મળી ગયા પછી, અમને સમજાયું કે અમારા ટ્રસ્ટસના અત્યારના હેતુઓમાં (ઓબ્જેક્ટ્સમાં) એવો હેતુ છે જ નહિ કે સિનીયર સિટીઝન્સ માટે સેન્ટર બનાવી શકાય. તેથી સલાહ મેળવવામાં આવી કે અમે યાલી આવેલા ટ્રસ્ટસના હેતુઓને બદલવા કરતાં નવું ટ્રસ્ટ બનાવવું વધારે સારું રહેશે.

અમોએ સંજાણમાં એક આલીશાન બંગલો ખરીદીને તેને સેનેટોરિયમમાં બદલી શકાય તેવા વિચાર સાથે, તેમજ પોતે ધંધો કરીને કમાણી કરવા માંગતા (સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે) માણસોને વ્યાજ વગરની નાની ઉછીની રકમ આપવાનો પ્લાન શરૂ કરવાના પ્રોજેક્ટ સારું પહેલાથી જ સીલ્વા સાથે વાતચીત શરૂ કરી હતી. અને તેથી એક નવું ટ્રસ્ટ - WZO ટ્રસ્ટ ફંડસ બનાવવામાં આવ્યું કે જેના ઘણા ઓબ્જેક્ટ્સ છે, એટલે કે ખાલી સિનીયર સિટીઝન્સ માટે સેન્ટર જ નહીં, પણ સેનેટોરિયમ પણ બનાવી શકાય.

WZO ટ્રસ્ટ ફંડસની નોંધણી ઓગસ્ટ ૩૧, ૧૯૯૫ ના રોજ કરાવવામાં આવી હતી ત્યાર પછી તરત જ અમે અમારું બાઈ માણેકબાઈ પી. બી. જીજીભોય સિનીયર સિટીઝન્સ સેન્ટર બનાવવાનું કામ શરૂ કર્યું.

ભોયતળીયું + ૫ માળ પર ફેલાયેલી ૨૦,૦૦૦ ચોરસ ફૂટનું મકાન બાંધવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો, લીગલ પરમિશન્સ મળી અને એપ્રિલ ૧૯૯૬ માં કામ શરૂ થયું. ૨૧ મહિનાની અંદર અમારું સેન્ટર વાપરવાલાયક અને બધી રીતે તૈયાર થઈ ગયું હતું.

સેન્ટરનું બિલ્ડિંગ બનાવવાનો બધો ખર્ચ તેમજ તેને પુરેપુરી બધી રીતે તૈયાર કરવાનો ખર્ચ સીલ્વાએ તેમના બાઈ માણેકબાઈ પી. બી. જીજીભોય ડીડ ઓફ સેટલમેન્ટ ફંડમાંથી ઉઠાવ્યો હતો.



તેની બધી જ કેડિટ સીલ્વાને જાય છે, એવણ વિઝનરી હતા, તેમને પહેલાથી ખ્યાલ આવી ગયો હતો કે અમારા સેન્ટરના કેટલાક રહેવાસીઓ પથારીવશ (બેડ રીડન) થઈ શકે છે, અને અમારું સેટઅપ જેઓ હાલીયાલી શકે તેવા લોકો માટે છે તે ધ્યાનમાં લઈએ, તો તેવા લોકો સારું અમારા સેન્ટરમાં સંભાળ રાખવાની મુશ્કેલી ઉભી થાય. તેથી સીલ્વાએ, જ્યારે સેન્ટરનું બાંધકામ ચાલી રહ્યું હતું તે વખતે નવસારીની તેમની એકની એક મુલાકાત વખતે જણાવ્યું કે આપણે નવસારી મધેની ઇન્ફર્મરી (એક બીજી ખુબ સારી સંસ્થા) સાથે જોડાણ કરવું જોઈએ, જેમાં જેઓ પથારીવશ થઈ ગયા હોય એવાં અમારા રહેવાસીઓને દાખલ કરવામાં આવશે. તે સમયે ઇન્ફર્મરી પાસે ઘણી બધી સગવડો નહિ હતી તે હકીકતને ધ્યાનમાં લઈને, સીલ્વાએ ઇન્ફર્મરીમાં વધારાની બિલ્ડિંગ બાંધવા માટે તરત જ ફંડ મંજૂર કર્યું.

વાહલા સીલ્વાએ, તેમના બાઈ માણેકબાઈ પી. બી. જીજીભોય ડીડ ઓફ સેટલમેન્ટ ફંડની મદદથી, ખરેખર પાચો બનાવવાનું કામ કર્યું હતું જેના પર અમારા ઘણા બધા પ્રોજેક્ટ્સ માટે વિચાર કરવામાં આવ્યો હતો, જે બધી યોજનાઓથી આપણા સમાજના હજારો લોકોની જીવનશૈલીને (લાઈફ સ્ટાઇલને) ઘણી ઉપર લઈ ગયા છીએ.

સીલ્વાને હંમેશા બીજાને મદદ કરીને ઘણું જ ઉંચું નામ મેળવનાર લેડી તરીકે યાદ કરવામાં આવશે. વાહલા સીલ્વા માટે અમો હંમેશાને માટે આભારી રહીશું, કારણ કે તેમના ટેકા વગર સેન્ટર દિવસનું અજવાળું પણ જોઈ ન શકતે.

બીજી જાણીતી વ્યક્તિ અમારી પોતાની બચી તંબોલી છે, મારી પત્ની તેમજ WZO ટ્રસ્ટ ફંડસના સ્થાપક ટ્રસ્ટી છે, કે જેના વગર શાંતિ અને હલીમલીને રહેવાની જીવતી જાગતી જગ્યા, આ સેન્ટર આજે છે તે નહીં હોતે. સેન્ટર હંમેશા યાવતું રહ્યું છે તેના પાછળનું કારણ એ છે કે બચીએ આપણા સિનીયર સિટીઝન્સ માટે કંઈક અલગ અને નક્કર કરવાના વિઝનને (દ્રષ્ટીને) પકડી રાખવાનું કામ કર્યું છે અને તેથી જ સેન્ટરે નામના મેલવી છે.

બચીએ સેન્ટરને બહુ ચોકસાઈથી સંભાલવાનું કામ કર્યું છે અને તેમાં તેની પરસાનીની પડછાયો જોવા મળે છે, મક્કમ પણ કાળજી સાથે સેન્ટરના રહેવાસીઓ માટે 'ઘરથી દૂર ઘર' હશે એવી સગવડો આપવાને ધ્યાનમાં રાખીને પ્લાનીંગ કરાય છે, જ્યાં બધાં રહેવાસીઓ, પછી ભલે તે પૈસા યુક્તતા હોય કે નહીં યુક્તતા હોય, બધા એક સરખી ફેસીલીટીસ સાથે આનંદથી રહેતા હોય, તેમની સેલ્ફ રીસ્પેક્ટ (સ્વમાન) અને મોભો હંમેશા જળવાયેલી રહે છે.

આ બે લેડીઝ, સીલ્વા અને બચી વગર, સિનીયર સિટીઝન સેન્ટર ખાલી એક સપનું બનીને રહી જતે.

અમે, અમારાં સેન્ટરને યલાવવા માટે સમયે સમયે મોટી રકમોની મદદ કરનારા જુદાજુદા ડોનર્સના પણ બહુ આભારી છીએ.

ખાસ કરીને હોગકોંગ, કેન્ટન અને મકાઓના ઝોરોસ્ટ્રિયન ચેરિટી ફંડસનો અમે ખરા જીગરથી આભાર માનીએ છીએ, કે જે લોકો યાવું દર ત્રણ-ત્રણ મહિને મદદ કરે છે.

## પોતાનામાં જોવું અને ઓળખવું:

### (Introspection & Reflection:)

અમે હંમેશા માનીએ છીએ કે અમે અમારી પોતાની જાતને ઓળખી કાઢી તેમાંથી બધા મુદ્દાઓને શોધશું, તેની મદદથી અમે અમારી પાયાની મજબૂત બાબતો ઓળખી કાઢશું તથા તેને વધારે મજબૂત બનાવી શકશું, અને તે જ અમને અમારા નબળા મુદ્દાઓને શોધી, નબળાઇ દૂર કરી તેને મજબૂત બનાવા સારું લાયક બનાવશે.

અમારાં શરૂઆતના દિવસોમાં શીખવા માટે તકલીફો પડતી હતી. એક સંસ્થાને યલાવવાનું કામ કરવું; કે જ્યાં જીવનના જુદાજુદા એરિયામાંથી આવેલા ૫૦+ હાલતાયાલતા સિનીયર સિટીઝન્સ જીવતાજાગતા વાતાવરણમાં શાંતિથી રહે છે, ખાય છે, સમય પસાર કરે છે અને એકબીજા સાથે સંબંધ બાંધે છે, તે જ ચોક્કસ રીતે નબળા દિલવાળા માણસો માટે નથી જ પણ પોતે જ એક સારો અનુભવ છે.

અમે એ જલદીથી શીખી ગયા કે જીવનના જુદાજુદા જગ્યાએથી આવેલા ઉંમરલાયક માણસોના ગ્રુપની સાથે કામ કરવું એ જાતેજ એક અટક્યા વગર યાવતી પ્રોસેસ છે, અને તે એમ ને એમ મેલવી શકાય એવી વસ્તુ નથી. અમે બહુ જ જલદીથી શીખ્યા કે જ્યારે પણ પ્રોબ્લેમ્સ ઉભા થાય ત્યારે જલ્દીથી અને કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વગર નિકાલ લાવવો, વાતચીત કરવી કે જે એક બહુ જ જરૂરી વાત છે. આપણી સંસ્થામાં જો સંપ હશે તોજ તે મજબૂત રહેશે પણ જો છુટા પડશું તો નબળા પડશું, દરેક માણસ એકબીજાને જોવાની નજરને સમજે અને તેની કદર કરે તેની ખાતરી કરવામાં આ રીત કામ કરી ગઈ છે.

મોટેભાગે, અમારા સેન્ટર માટે આશીર્વાદવાળી વાત એ છે કે સેન્ટરના રહેવાસીઓ, બધા માણસો દયાળુ છે, એકબીજાને મદદ કરે છે, જ્યારે તેમની સાથે જ રહેતા માણસને પરસનલ પ્રોબ્લેમ આવી પડે છે ત્યારે તેનો સામનો કરવા ખાસ કરીને મદદ કરે છે.

કોઈક વખત માંદા પડતા હોય તેવા લોકો સિવાયના, બીજા બધા

રહેવાસીઓ, એકસાથે બેસીને ભોનું ખાઈ છે, કેરમ તથા કાફી રમવામાં, ટેલિવિઝન જોવામાં સમય પસાર કરતાં, ક્યારેક ગીતો ગાવામાં, એકબીજાને સલાહ આપતા કે સલાહ મેળવતા, એક મોટા ફેમીલીના મેમ્બરની જેમ એકબીજા સાથે જોડાયેલા હોય છે, આ વસ્તુઓ ખરેખર જોવાને લાયક છે.

કદાચ આ અમારી એકજ એવી સંસ્થા છે, જ્યાં આપણી કોમના અમારા રહેવાસીઓમાંથી બે જોડાઓ લગ્ન કરીને જોડાવાનું નક્કી કર્યું હતું. બહુજ જ ખુશાલી અને પ્રાઈડ લેવાની આ વાતો હતી, તે બતાવે છે કે અમારુ સેન્ટર હંમેશા યાવતું જ રહે છે.

જેમ કે અમારા રહેવાસીઓ હાલતાયાલતા રહે એ અમારાં માટે ખાસ વાત છે, અમે વર્ષોથી તેમના માટે બહાર ફરવા લઇ જવાની સગવડ કરીએ છીએ, ઉદવાડા ખાતે ઇરાનશાહની વિઝીટ લેવા અને નજીકમાં સંજાણ ખાતે અમારાં સેનેટોરિયમમાં રહેવા માટે થોડા દિવસો પસાર કરે છે. આ બહારગામની ટ્રીપ બહુ જ જરૂરી અને મજા માંગે તેવી બાબત છે.

## અમારી મેનેજમેન્ટ ટીમ અને સ્ટાફનો આભાર:

અમે બહુ જ નસીબદાર છીએ કે અમારી સાથે શારમીન, હોમી, સરોષ અને શામ છે, જે લોકોએ એક ડેડીકેટેડ (સમર્પિત) ટીમ બનાવી છે, જે રોજરોજના કામકાજ સંભાલે છે, અમારી ૫ લેડીસની ટીમ કે જે લોકો કિચનમાં રાંધવાનું કામ સંભાલે છે અને રોજરોજ નવીનવી ટેસ્ટી વાણીઓ બનાવે છે, ૪ કિચન હેલ્પર અને બીજા ૧૬ લેડીસનો સપોર્ટ સ્ટાફ, જે રૂમ્સની સફાઈ કરે છે અને સેન્ટરને હંમેશા ચોખ્ખું રાખે છે.

તેઓ તેમને સોંપેલ કામ પુરાં ડેડીકેશનથી કરી તેમની ફરજો નિભાવે છે તે બદલ અમે તેમનો ખરા જીગરથી આભાર માનીએ છીએ.

આ તકે અમે અમારાં રાંધવાવાલા બે લેડીસ ખોરશેદ અને બેપ્સીને યાદ કરીને તેમને આપેલ સેવા સારું આભાર માનીએ છીએ. તેઓ શરૂઆતથી ૨૩ વર્ષ સુધી અમારી સાથે હતા કોવિડ-૧૯ ની અસરથી તેઓ આપણી વચ્ચે રહ્યા નથી. અમે, અમારા અગાઉના મેનેજર સોલીની સેવાઓને પણ બિરદાવીએ છીએ કે જેઓ પણ અમારી સાથે ૨૩વર્ષ સુધી સાથે હતા પણ નાદુરસ્ત તબિયતને લીધે રીટાયર્ડ થયા છે.

## અંતમાં:

છેલ્લે, અમે હંમેશા એ ઈચ્છા રાખીએ છીએ અને નક્કી કરીએ છીએ કે, રોજ અમારા રેસિડન્સની તેમના જીવનની સાંજ તેમના હસતા હસતા હોઠ સાથે પસાર કરે, તેમની આંખોમાં આંસુ નહિ આવે, તેમની કરચલીઓની જગ્યાએ ચમક હોય, તેમને હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જેના જીવનમાં સુંદરતાને વખાણવાની તાકાત હોય છે, તેઓ ક્યારેય ડોસા થતા નથી, જે લોકો માટે ઉમર ખાલી એક નંબર છે.

અમારા રહેવાસીઓ, રોબર્ટ બ્રાઉનિંગના અમર શબ્દોનું એક ઉદાહરણ છે:

આવો, મારી સાથે વૃદ્ધ થાઓ!  
સર્વશ્રેષ્ઠ આવવાનું હજી બાકી છે,  
જીવનનો એ અંતિમ,  
કે જેના માટે રચાયો પ્રથમ

*DeSamboly*

દિનશા કે. તંબોલી;  
ચેરમેન



Our Chef's on the job



Jumbo prawns ready for serving



A section of our residents with Administration, Staff & Trustees



Visiting residents who needed to be hospitalised at D. N. Mehta Hospital



Our 97 years young resident Perin, being fed in the sick room



# Food & Meals



55 residents and 20 staff members, for a total of 75 people are fed every day at the Bai Maneckbai P.B. Jeejeebhoy Senior Citizen Centre.

Food is served 5 times during the day:

**7am: Morning Tea**

**9am: Breakfast**

**12:30pm Lunch**

**4pm: Evening Tea and Snacks**

**8pm: Dinner**

All residents eat together in the dining hall. This allows them to share conversation over their meals, strengthening their friendships and making them feel more connected to one another.

Having a craving for Dhansak or Boi or Malido? No worries, each resident has an opportunity to share what they would like to eat in a journal that is maintained in the dining hall.

Vegetarian and Non-Vegetarian meals are served. Diabetic friendly meals are also offered at each meal. For residents who have special needs, liquefied meals are also prepared.

Birthdays are special and each resident is allowed on their special day to decide what the menu for the day will be. All residents come together to celebrate while the birthday resident cuts a cake.

In the event that a resident doesn't like what's on the menu, they are offered fried eggs, scrambled eggs or omelettes.

Food is a way of connecting with ourselves and with others, for Parsis especially it is not only an integral part of our growing up, but also tied closely with what brings us joy. It is our hope, every day, to create joy, camaraderie and a unique sense of belonging through the food and meals we serve.






## SAMPLES OF ITEMS ON OUR DAILY MENU

Breakfast	Lunch	PM Snack	Dinner
Ravo, Bread Butter-Jam, Milk	Chicken Biryani, Curd Salad	Ragda Patties	Butter Chicken, Roti, Ice-cream
Masala Poha (Pauva), Milk	Mutton Biryani, Curd Salad	Various types of Masala Puri	Paneer Bhurji, Roti
Akooari, Rotli, Butter, Milk	Chicken Pulav, Dal	Papad Poha (Pauva)	Papeta/Bhinda/Tomato-par-indu, Roti
Parsi Omllette, Butter, Roti, Milk	Mora Dal Chaval, Egg/Fish/Prawns Patio or Vengan-ni-kaatri	Various Biscuits/ Toast/ Cake	Titoli, Omllette, Roti
Sabudana Khichdi, Milk	Fish Curry, Rice	Parsi Bhakhara	Turkish Chicken, Roti
Scrambled Egg, Milk, Butter, Roti	Chicken Gravy, Rice	Different type of Bhajiya	Mutton Potato Gravy, Roti
Raabdi, Lila-lasan-nu-indu, Rotli, Butter	Idli Sambhar, Chutney	Dal-ni-pori	Stew, Roti
Sev, Curd, Banana	Dhosa, Sambhar, Chutney	Sev Mamra / Chevdo/ Sakarpada/ Gathiya	Various Vegetable (Cauliflower, French Beans, Guvar, Ladies Finger, Cabbage)
Vasanu, Egg, Rotli, Butter	Chhole, Puri, Murabbo	Jam Puff	Palak Paneer, Roti
Thepla, Murabbo, Milk	Aloo Paratha, Curd	Steam Dhokla	Various Pulses (Moong Dal, Chora, Masoor, Moong, Chana-ni-dal)
Upma, Butter, Roti	Mutton Dhanshak, Kachumbar, Lemon	Sandwich	Usal Paav
Chaapat, Milk	Mince Kofta Curry, Rice	Laddu	Chicken Khurchan, Roti
French Toasts, Milk	Prawns Pulav, Ketchup	Faaludo	Potato Shak, Shrikhand, Puri
Corn Flakes, Butter, Toast	Kadhi Khichdi, Any Veg, Papad	Mathiya/ Chora Fari	
Khaman Dhokla or Idla, Milk	Paya-Khariya Gravy, Rice, Kachumbar	Dal Vada	
Vegetable Sandwich, Milk	Green Peas Pulav, Kadhi, Papad		
Sev-khamni, Raabdi	Masala-ni-dal, Rice, Mutton/Veg Kabab		
Vaal-ni-daal, Rice	Curry, Rice, Fried Fish		



# Rooms & Living



Residents have the option of multiple rooming options. At our Senior Citizen Centers we have:

**Single Rooms: 22**

**Double Rooms: 10**

**Quadruple Sharing Rooms: 4**

**A Sick Room which can accommodate up to 6 residents**

**Yoga / Physiotherapy Room: 1**

Each room is fully furnished and each resident is encouraged to make their living space their own by adding their own special touches.

We try to make living at the Senior Centre as close to home as possible. There is a housekeeper assigned to each floor. Every day the housekeeper goes to each room, on the floor to sweep, mop, dust and wash the resident's clothes. We do not use washing machines to wash the seniors' clothes. Clothes are washed in the bathroom attached to their rooms itself.

An independent and active life is encouraged. In the event anyone falls sick we take special care of them in the sick room. We help feed them, bathe them, given them their medicine and keep them

company while in the sick room. We ensure their respect and dignity is maintained at all times, just like it would be, in their own homes. In the unfortunate event that our resident becomes bedridden, they are transferred to the Navsari Infirmary, another excellent institution managed by Navsari Samasth Parsi Anjuman.

Doctors visit regularly to keep a check on the blood pressure of residents, temperature and other baseline parameters. Yoga and Physiotherapy sessions are held thrice a week. A Parsi chemist visits the centre every day to take orders for routine medicines required by residents and delivers them the next day.

From time to time residents are taken on outings to WZO Trust Funds Sanjan Sanatorium and visits to Iranshah in Udvada.

Residents are encouraged to go out between meal times; however, are requested to be home by meal times. It is an essential requirement that all residents should have their meals together.

We are dedicated to giving them Rooms and Living that are as close to home as possible, filled with love, care and comfort.



*When our residents are unwell, our best efforts are to have them treated at the centre or if that is not possible they are transferred to D. N. Mehta Sarvajanic Hospital (popularly known as Parsi Hospital which has over the years evolved into a multi speciality hospital, where we have our own WZO Trusts ward. Should residents or their families wish to get them admitted to any other hospital of their choice they are welcome to do so.*





Physiotherapy sessions by  
Physiotherapist Shivani Joshi



Our caring Housekeeping team



Our active enthusiast, Marzban



Visiting residents who needed to be hospitalised at D. N. Mehta Hospital

# We Welcome Donations



## FOR REMITTANCES IN USD FROM BANK ACCOUNT OVERSEAS

Bank Details for remitting funds in US DOLLARS (USD) to Account of The WZO Trust Funds with State Bank of India, New Delhi Main Branch.

### Correspondent Bank

Bank Name: State Bank of India New York  
SWIFT Code: SBINUS33

### For Credit To

A/C No. with SBINUS33: 77600125220002  
Bank Name: State Bank of India, New Delhi Main Branch  
Address: Main Branch, Parliament Street, New Delhi-110001

### For Final Credit to Beneficiary

Beneficiary A/c #: 40088188141  
Beneficiary Name: The WZO Trust Funds  
SWIFT Code of State Bank of India,  
New Delhi Main Branch: SBININBB104

*(Please request your Bankers to mention Purpose Code P1303 – Donations to Religious and Charitable Institutions - while making remittance by SWIFT/Wire, else our account may not get credited)*

## BANK DETAILS FOR ONLINE DONATIONS WITHIN INDIA

Name of Bank: Deutsche Bank

Branch Name: Hazarimal Somani Marg, Fort, Mumbai

Branch Address: D B House, Hazarimal Somani Marg, Fort, Mumbai 400 001

Account Title: The WZO Trust Funds

Account Number: 400004256780019

Account Type: Savings

IFSC Code: DEUT0784PBC

### NOTE:

*IFSC Code (DEUT0784PBC) is common for all Branches of Deutsche Bank in India. If Khar Branch or any other Branch gets displayed while keying in this IFSC Code please go ahead and complete the online transfer; After remittance is made please inform us on [admin@wzotrust.com](mailto:admin@wzotrust.com) and quote PAN Number and address where our Receipt is to be sent*

AD1997

THE W.Z.O. TRUST  
FUNDS

BAI MANECKBAI P. B. JEEJEEBHOY SENIOR CITIZENS CENTRE

